

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

અ.નં.	વિગતો	
૧	યોજનાનું નામ / પ્રકાર	રાષ્ટ્રિય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ
૨	યોજના શરૂ થયાનું વર્ષ	૧૯૫૫
૩	યોજનાનું નાણાંકીય સ્ત્રોત	ભારત સરકાર - સેન્ટ્રલ લેપ્રસી ડીવીઝન, નવી દિલ્હી
૪	યોજનામાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો	સને ૧૯૮૩
૫	યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ	(૧) રક્તપિત્તના ચિન્હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર મફત પુરી પાડવામાં આવે છે.
		(૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રક્તપિત્તગ્રસ્તોને માઇક્રો સેલ્યુલર રબર (એમ.સી.આર.) શૂઝ મફત પુરા પાડવામાં આવે છે.
		(૩) વિકૃતિ ધરાવતા તમામ રક્તપિત્તગ્રસ્તોને રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી ભારત સરકારશ્રી માન્ય સેન્ટર (૧) સીવીલ હોસ્પિટલ- અમદાવાદ, (૨) એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે મફત કરી આપવામાં આવે છે.
૬	યોજના અંતર્ગત સહાય/લાભ	(૧) રક્તપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસ્પિટલમાં મફત પુરી પાડવામાં આવે છે.
		(૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રક્તપિત્તગ્રસ્તોને માઇક્રોસેલ્યુલર રબર શૂઝ (એમ.સી.આર.) વર્ષમાં બે વાર મફત પુરા પાડવામાં આવે છે.

		(૩) વિકૃતિ ધરાવતા રક્તપિત્તગ્રસ્તોને વિકૃતિ દૂર કરવા માટે રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી ભારત સરકારશ્રી માન્ય સેન્ટરમાં કરાવવામાં આવે છે. તેમજ મેજર સર્જરી કરાવેલ બી.પી.એલ. કાર્ડ ધારકને રૂ.૫૦૦૦/- , તેમજ આર.સી.એસ. માટે માન્ય સેન્ટરને મેજર સર્જરી દીઠ રૂ.૫૦૦૦/- ચુકવવામાં આવે છે.
		(૪) રક્તપિત્તગ્રસ્તોને રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી માટે દાખલ કરવામાં આવે ત્યારથી હોસ્પિટલમાંથી ડીસચાર્જ થાય ત્યાં સુધી વેજલોસ દૈનિક રૂ.૫૦/- મહત્તમ ૨૦ દિવસ સુધી ચુકવવાની જોગવાઈ છે.
		(૫) લેપ્રસી ડીવીઝન, નવીદિ, ભારત સરકાર તરફથી સ્વૈ.સંસ્થાઓને એસ.ઇ.ટી. સ્કીમ ચલાવવા માટે આર્થિક સહાય - ફંડ પુરુ પાડવામાં આવે છે.
		(૬) સ્વૈ. સંસ્થાઓ સંચાલિત ૩ હોસ્પિટલોને પથારીદીઠ સંખ્યા મુજબ આર્થિક સહાય ચુકવવામાં આવે છે.
૭	યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ	MCR શુઝ - એમ.સી.આર.શુઝ મેળવવા માટે રક્તપિત્તગ્રસ્ત જરૂરિયાત મંદ દર્દીને કોઈ આધાર પુરાવાની જરૂર રહેતી નથી.આર.સી.એસ. - ૧. મેજર આર.સી.એસ. કરાવેલ રક્તપિત્તગ્રસ્તે બી.પી.એલ. કાર્ડ ધારક છે.તેનો સક્ષમ અધિકારીશ્રીનો પુરાવો(બી.પી.એલ. કાર્ડ) રજૂ કરવાનું રહેશે.૨. ભારત સરકાર ધ્વારા માન્ય કરેલ સંસ્થામાં ઓપરેશન કરાવેલ છે. તેનો દસ્તાવેજી પુરાવો(સંસ્થાનું નામ(૧) એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા (૨) નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ) ૩. રક્તપિત્તગ્રસ્ત આર.સી.એસ. ઓપરેશન માટે હોસ્પિટલાઇઝેશન થયેલ છે તેનો પુરાવો.

૮	યોજનાનો લાભ કયાંથી મળશે.	૧. MCR શુઝ - જિલ્લા રકતપિત અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીશ્રીની કચેરી ધ્વારા. 2. RCS - એજન 3. MDT - તમામ પી.એચ.સી./સી.એચ.સી., જનરલ હોસ્પિટલમાં મફત પુરી પાડવામાં આવે છે.
---	--------------------------	---